

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રાજકોટ ખાતે ઔદ્યોગિક, વાણિજ્યક, રોકાણલક્ષી મુદ્દાસર રજૂઆત.....

પ્રવર્તમાન કોરોના મહામારીના કારણે ઉદ્ભવેલ અત્યંત વિકટ અને વિષય પરિસ્થિતિને કારણે તેમજ અન્ય વૈશ્વિક સમીકરણો સબબ વિશ્વના કેવી ઔદ્યોગિક એકમો ભારત ખાતે સ્થળાંતરિત થવાના સંજોગો ઉપસ્થિત થયેલ છે. રાજકોટ ખાતે વિશાળ ઔદ્યોગિક વાણિજ્ય રોકાણલક્ષી એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પાર્ક ઉભુ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્ય મંત્રીશ્રીને જોરદાર અને મુદ્દાસર રજૂઆત કરવામાં આવેલ છે.

- (૧) રાજકોટ જીલ્લા ખાતે ૧૦૦ ચો.કિ.મીટર જમીન કરતી દિવાલ સાથે ફાજલ કરવી.
- (૨) તમામ માળખાગત સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગટર, પાણી, ગેસ, કેપ્ટીવ પાવર પ્લાન્ટ, પ્રદુષણ નિવારણ વિજળીકૃત રેલ સેવા વગેરે પુરી પાડવી.
- (૩) તમામ સરકારી પ્રકીયાઓ જેવી કે એસ.ડી.એમ. ઓફિસ, પ્રદુષણ નિવારણ બોર્ડ, જી.એસ.ટી. ઓફિસ, ઔદ્યોગિક કમીશ્નર કચેરી, એકસાઈઝ, કસ્ટમ, વિદેશ વ્યાપાર નિયામક, નાના અને મધ્યમ ઉદ્યોગ ચાલુ ગૃહ કચેરી, આઈટીઆઈ પોલીસ સ્ટેશન સહિતની તમામ સુવિધાઓ એકજ સ્થળે ઉપલબ્ધ કરાવવી.
- (૪) તમામ વાણિજ્ય સેવા સંલગ્ન યુનિટ જેવા કે બેન્ક, ઇન્સ્યોરન્સ, નાણાકીય ધિરાણ પૂરા પાડતા એકમો પ્રસ્થાપિત કરવા.
- (૫) મુન્દ્રા અને પિપાવાવ બંદર સાથે સીધુ રેલ જોડાણ ધરાવતો ઇનબીલ્ટ કંટેઈનર ડેપો નિવારણ કરવો.
- (૬) મજુરો તથા ઓફિસકામ કરતા કર્મચારીઓ માટે ૧ બીએચકે તથા ૨ બીએચકે સાથેની રહેઠાણ વ્યવસ્થા પુરી પાડવી.
- (૭) તમામ મજુર કાયદાઓ માંથી મુક્તિ આપવી.

રાજકોટ જીલ્લામાં કોઈપણ સ્થળે પ્રસ્થાપિત થનારા સદર પાર્કમાં ઓછામાં ઓછી ૨૫ ચો.કિ.મીટર જમીન અને પ્લાન્ટ મશીનરી પેટે ઓછામાં ઓછા એક હજાર કરોડ રૂપિયાનું ધિરાણ તથા ૫૦૦ વ્યક્તિને સીધી રોજગારી પુરી પાડવા નીચેના કારણોસર સુચવાયેલ છે.

- (૧) સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ ખાતે આવા વિશાળ ધિરાણ લાયક સંકુલ આવેલ નથી.
- (૨) હઝીરા, દહેજ, નોઈડા જેવા વિશાળ ઔદ્યોગિક સંકુલો રાજકોટ ખાતે સ્થપાવાની તીવ્ર જરૂરિયાતો જણાય છે.
- (૩) પાંચ હજાર કરતા પણ વધુ નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમો ધરાવતું રાજકોટ પ્રસ્તાવિત પાર્કને ખૂબજ ઉપયોગી અને મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે.

(૪) મુન્ના અને પિપાવાવ બંદર સાથે રાજકોટ ધનિષ્ટ રીતે સંકળાયેલું છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વિશેષ યાદી મુજબ ઉપરોક્ત યોજના અર્થે ખૂબ જ વિસ્તૃત વિશ્લેષણ અને બારીકાઈપૂર્વકના અભ્યાસને અંતે રજૂઆત તૈયાર કરાયેલ છે. જેને માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રૂબરૂ રજૂ કરવાની પરવાનગી માંગેલ છે.

સમગ્ર સૌરાષ્ટ્ર માટે અત્યંત લાભદાયક અને જીવાદોરી સમાન ઉપરોક્ત ધિરાણ યોજનાના અમલીકરણ બાબત રાજકોટ ચેમ્બર ખૂબ જ સક્રીય અને આશાવાદી છે અને આ બાબતે હાથ ધરાયેલ વિવિધ પ્રક્રિયાઓ તથા વિકાસ અંગે સભ્યશ્રીઓને માહિતગાર કરવામાં આવશે. સાથોસાથ સમગ્ર રાષ્ટ્ર કક્ષાના અતિ પ્રતિષ્ઠિત અને કિંમતી પ્રોજેક્ટની પ્રાપ્તિ અર્થે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણ સાથ સહકાર પૂરો પાડવા જણાવેલ છે.